



Oasis Dream India Camps Vision Statement

by Oasis Movement

***A Vision Statement Created in Dream India Camp Learning Retreat
During 14th march to 16th march, 2019 at Oasis Valleys***

ડ્રીમ ઇન્ડિયા (આપણા સ્વપ્નનું ભારત)

- આપણા સ્વપ્નનું ભારત એવું હશે જ્યાં અભય, શાંતિ, પ્રસન્નતા અને વિકાસ હશે. જ્યાં જન્મ લેનાર પ્રત્યેક અસ્તિત્વ પોતાના જન્મના હેતુને પામશે અને જીવનને માણીને સાર્થક બનાવશે. તેમાં પ્રત્યેકને આદર હશે, પરસ્પર સન્માન હશે, બધાં જ એક બીજાની અનન્યતાનો સ્વીકાર કરતા હશે.
- તેના પ્રત્યેક વ્યવહારમાં પ્રામાણિકતા, પ્રેમ, નિઃસ્વાર્થતા, મિત્રભાવ, કૃતજ્ઞતા, સ્વાવલંબન, પરસ્પરાવલંબન, સ્વતંત્રતા, નીડરતા, હિંમત, સાહસ, રાષ્ટ્ર પ્રેમ, ચારિત્ર્યની એકસૂત્રતા, સમાનતા, સર્જનશીલતા, ઉત્સાહ, ભાઈચારો, વિશ્વબંધુત્વ, પારદર્શકતા, પવિત્રતા – આ બધાં જ મૂલ્યો વણાયેલાં હશે.
- પ્રત્યેક બાળક અત્યંત મહત્ત્વનું હશે, જેને ભવિષ્યના મહાન વ્યક્તિ તરીકે જોવામાં આવશે.
- દરેકના પ્રત્યેક આચરણમાં ‘સ્વ’ નો નહીં પરંતુ ‘સર્વ’નો ભાવ હશે.



Vision Statement Creators

આ સ્વપ્નને સાકાર કરવા નીચે મુજબની શિક્ષણ પ્રણાલીઓ હશે.

- શિક્ષણ પ્રણાલીમાં વૈદિક શિક્ષણ, સમરહિલના સિદ્ધાંતો અને સાંપ્રત સમયની પ્રણાલિઓના શ્રેષ્ઠ અંશોનો સમન્વય હશે.
- પ્રત્યેક વ્યક્તિને દામ્પત્ય જીવન અને બાળ ઉછેરના પાઠ શિક્ષણના ભાગ રૂપે શીખવવામાં આવશે, જેથી તમામ બાળકો સર્જન હોય, અકસ્માત નહીં.
- બાળકના શિક્ષણની શરૂઆત ગર્ભ સંસ્કારથી જ થશે. જન્મ પછી તેનું સહજ શિક્ષણ પરિવાર દ્વારા જ થતું હશે.
- બાળક પોતાની રસ-રુચિ પ્રમાણે શીખે, ખીલે અને વિકસે એ માટેનાં માધ્યમો હશે.
- સર્જનાત્મક અને સકારાત્મક અભિગમ સાથે કેળવણી જીવનલક્ષી, ગુણલક્ષી તેમજ કૌશલ્યપ્રધાન હશે.
- શિક્ષણ પ્રણાલી નોન-જજમેન્ટલ હશે, જેમાં બાળકો કે વ્યક્તિઓ વચ્ચે સ્પર્ધા, સરખામણી, અપેક્ષાઓનો બોજ, અને બિનજરૂરી રોક ટોક નહીં હોય.
- શિક્ષણનું ધ્યેય સર્વાંગી એટલે કે શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને અધ્યાત્મિક વિકાસ હશે.
- પ્રત્યેક વ્યક્તિ સ્વરક્ષણ માટે પ્રશિક્ષિત હશે.
- શિક્ષણનું માધ્યમ પ્રવૃત્તિ, કળા અને રમત-ગમત હશે, પ્રકૃતિ અને સંસ્કૃતિનાં જતન અને સંવર્ધનલક્ષી કેળવણી હશે.
- શિક્ષણ શ્રમનું ગૌરવ કરનાર અને સ્વાવલંબનથી પરસ્પરાવલંબન તરફ દોરી જનાર હશે.
- “મારું જીવન મારી જવાબદારી” એ કેળવણીનું હાર્દ હશે. અને આ સત્ય પ્રત્યેક વ્યક્તિ પુનઃ પુનઃ શીખતી રહેશે.

ટૂંકમાં આપણા સ્વપ્નનું ભારત “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવનાનું જીવંત ઉદાહરણ હશે.



***“RECEIVE THE CHILDREN **IN REVERENCE**
EDUCATE THEM IN LOVE, AND
SEND THEM FORTH IN FREEDOM.”***

- Rudolf Steiner



Oasis Movement

2nd Floor, Shalin Apartment, 52, Haribhakti Colony,
Race Course, Vadodara-390007, Gujarat, India

Teleflex: +91-265-2321728

Email: info@oasismovement.in